



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૨/૦૨/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૪૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૬ કેસ કરી, ૨૬ વ્યક્તિઓને ઝડપી, ૪૧ લીટર દેશી દારૂ અને ૦૩ બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૪૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૩૪૨/૧૯

ઓઢવ : વૈભવભાઈ પ્રવિણચંદ્ર શાહ (ઉ.વ.૩૮)(રહે. સુમંગલમ ફ્લેટ એચ.ડી.એફ.સી.બેંક પાસેની ગલીમાં મીઠાખળી છ રસ્તા પાસે નવરંગપુરા) એ તા.૨૧/૦૨/૨૦૧૯ ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સપ્ટેમ્બર/૨૦૧૫ થી સપ્ટેમ્બર/૨૦૧૮ સુધીના સમયગાળા દરમ્યાન તથા તા.૨૦/૦૨/૨૦૧૯ ના કલાક ૧૦/૦૦ થી કલાક ૧૦/૩૦ દરમ્યાન આરોપી (૧) સંજય હરીપ્રસાદ અગ્રવાલ (૨) અશોક હરીપ્રસાદ અગ્રવાલ અને (૩) આદિત્ય સંજય અગ્રવાલ (રહે. સફલ રેસીડન્સી ત્રીજો માળ ડી-માર્ટ સુપર માર્કેટ પાસે સેટેલાઈટ)(જે તમામ શ્રીબાલજી ટેક્સ ફેબ, શ્રી વિનાયક ટેક્સ ફેબ ના સંચાલકો) એ ભેગામળી ઓઢવ જી.આઇ.ડી.સી.ખાતે આવેલ ઇકવીનોક્ષ ઇમ્પેક્ષ નામની વૈભવભાઈની પેઢીમાંથી તેઓની વિનાયક ટેક્સ ફેબ તથા શ્રીજી ટેક્સ ફેબ કંપની માટે લઈ ગયેલ કુલ ૨૭ ટન ૫૬૦ કિ.ગ્રા. “રીએક્ટીવ ડાઇસ” કાપડમાં વપરાતા રંગ રસાયણનો માલસામાન કુલ કિંમત રૂપિયા ૧,૨૦,૭૮,૧૩૦/- નહી ચુકવી, વૈભવભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.જી.જાડેજા ચલાવે છે.

ધરફોડ :-

સમાચાર યાદી નં.૩૪૩/૧૯

શાહીબાગ : રમેશચંદ્ર માંગીલાલ જૈન (ઉ.વ.૫૭)(રહે. સુજાતા ફ્લેટ શાહીબાગ) એ તા.૨૧/૨/૧૯ ના રોજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૭/૨/૧૯ ના કલાક ૦૦/૦૦ થી સવારના ૭/૦૦ વાગ્યા દરમ્યાન રાજસ્થાન હોસ્પિટલ સામે આવેલ મણીભદ્ર કોમ્પ્લેક્ષ દુકાન નં-૦૪ અને ૦૫ મા “જૈન બિઝનેસ સેન્ટર” નામની રમેશચંદ્ર ની દુકાનનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી, ટેબલના ખાનામાંથી રોકડ રૂપિયા ૪૫,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એ.દેસાઈ ચલાવે છે.

લુંટ :-

સમાચાર યાદી નં.૩૪૪/૧૯

વસ્ત્રાપુર: ચરણસિંહ હરગોવીંદ મોર્યા (ઉ.વ.૨૯)(રહે.જીજર હોટલ ના સ્ટાફ રૂમમા એસ.જી.હાઇવે થલતેજ) તા.૨૧/૦૨/૨૦૧૯ ના કલાક ૧૧/૧૫ થી ૧૧/૪૫ વાગ્યા દરમ્યાન એસ.જી.હાઇવે જી.એન.એફ.સી. ટાવર પાસે આવેલ બેંક ઓફ બરોડા આગળ શંભુ કેફેબાર નજીકથી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન બે અજાણ્યા પુરૂષ (૨૮ થી ૩૦ વર્ષના આશરના) એ ભેગામળી ચરણસિંહ ના શર્ટ ના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૩૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન ખેંચી ઝુટવી લઇ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ચરણસિંહ મોર્યાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.આ ગુનાની તપાસ પોસ.શ્રી ડી.જી.રબારી ચલાવે છે.

લુંટ :-

સમાચાર યાદી નં.૩૪૫/૧૯

સાબરમતી : (૧) જીતેન્દ્રભાઈ ભીખાભાઈ પરમાર (ઉ.વ.૫૧)(રહે.હીરાધાન સીટી સ્નેહપ્લાઝા બસ સ્ટેંડની બાજુમા આઈ.ઓ.સી રોડ ચાંદખેડા) એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૨/૨૦૧૯ ના કલાક ૦૭/૪૫ થી ૦૮/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન સાબરમતી પાવર હાઉસ બ્રીજના છેડે ચાર અજાણી વ્યક્તિઓએ ભેગામળી જીતેન્દ્રભાઈની નજર ચુકવી તેમના ખિસ્સાના આગળના ભાગે કોઈ વસ્તુ વડે ચેકો મારી ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૩૫,૦૦૦/- ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.જે.દેસાઈ ચલાવે છે.

સાબરમતી : (૨) રામનરેશ સરજુપ્રસાદ ચૌહાણ (ઉ.વ.૬૩)(રહે.ગોતા હાઉસિંગ બોર્ડ ગોતા) એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૨/૨૦૧૯ ના કલાક ૧૨/૧૫ થી ૧૨/૩૦ સુધીના સમયગાળા દરમ્યાન સાબરમતી રામનગર બેંક ઓફ ઈંડીયા ખાતે કેશ કાઉંટર ની લાઈન માં પૈસા ભરવા ઉભેલ રામનરેશ ની નજર ચુકવી તેમના શર્ટના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૧૧,૨૫૦/- ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી શનાભાઈ ધુળાભાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૩૪૬/૧૯

સરદારનગર : રાકેશભાઈ અર્જુનભાઈ યુનારા (ઉ.વ.૨૨)(રહે.યુનારાવાસ-૧ મોદી કંમ્પાઉંડ કુબેરનગર) એ અગમ્ય કારણસર તા.૨૧/૦૨/૧૯ સાંજના ૪/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રદીપસિંહ મહિપાલસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.